

Monday, March 4, 2024

To,
The General Manager
Listing Operation,
BSE Limited,
P.J. Towers, Dalal Street, Mumbai – 400 001,
Maharashtra, India

Dear Sir/Madam.

Ref.: Proposed Rights Issue of Equity Shares of Shree Ajit Pulp and Paper Limited (the "Company").

Sub.: Intimation as per Regulation 92 of the Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018, as amended (the "SEBI ICDR Regulations") and Regulation 30 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended ("SEBI Listing Regulations").

This has reference to the captioned Rights Issue in respect of which the Company had filed a Letter of Offer dated January 15, 2024 ("**LOF**") with the BSE Limited and the Securities and Exchange Board of India. The captioned Issue opened for subscription on Tuesday, January 30, 2024 and closed on Tuesday, February 20, 2024.

In this regard, this to inform you that the basis of allotment advertisement dated March 2, 2024, in terms of regulation 92 of the Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018, as amended, has been published in the following newspapers on March 4, 2024:

- 1. Financial Express (English) National daily All Editions.
- 2. Jansatta (Hindi) National Daily All Editions.
- 3. Lokmitra Gujarati Vapi Editions

We are submitting herewith the newspaper e-clippings of above mentioned newspapers. Kindly take the same on your records and acknowledge the receipt.

Thanking you,

For, Shree Ajit Pulp and Paper Limited

Shanoo Mathew Company Secretary and Compliance Officer

Enclosed: As above

## SHREE AJIT PULP AND PAPER LIMITED

Regd. Office:

Survey No. 239, Near Morai Railway Crossing, Village Salvav, Via-Vapi, Dist. Valsad,

Pin.: 396191, Gujarat, India. Tel.: +91 260 6635700 Facsimile : +91 260 2437090

CIN: L21010GJ1995PLC025135

Works:

Survey No. 239, Village Salvav, 106, 107, 108P & 105P,

Morai, Near Morai Railway Crossing,

Via-Vapi, Pin.: 396 191, Dist. Valsad, Gujarat, India

Email : shreeajit@shreeajit.com Website : www.shreeajit.com **FINANCIAL EXPRESS** 

INVEST UP

# **INVEST UP**

2<sup>ND</sup>, 4<sup>TH</sup> & 6<sup>TH</sup> FLOOR, BLOCK-A, PICUP BHAWAN, GOMTI NAGAR, LUCKNOW-226010 (U.P.) Website: www.invest.up.in, Email: info@investup.org.in, Tel: 0522-2720231

ADVT No. IUP/SKS/245/20247

Dated: 04th March, 2024

Applications are invited in prescribed format from eligible & experienced candidates for the following posts. Applications will be accepted on Invest UP's website: www.invest.up.gov.in/career/.

Sr. No.	Name of Post	No. of Post
1	General Manager (Investment Promotion)	01
2	Asst. General Manager (Investment Promotion)	01
3	General Manager (Udyami Mitra)	01
4	Asst. General Manager (Udyami Mitra)	01
5	General Manager (Legal)	01
6	General Manager (Policy)	01
7	Asst. General Manager (Electric Vehicle Manufacturing & Mobility Policy)	01
8	Asst. General Manager (UP Industrial Investment & Employment Promotion Policy)	01
9	General Manager (Coordination)	01
10	General Manager (Infrastructure)	01
11	Asst. General Manager (Infrastructure-Power)	01

- For details of educational/technical qualification, age, eligibility, experience, application format etc. kindly visit Invest UP website https://invest.up.gov.in/career/
- Only online applications shall be accepted for the above posts
- Last date for the submission of online applications is 30.03.2024 by 5:00 PM

Chief Executive Officer, Invest UP



(This is an Advertisement for information purposes only and not for publication or distribution or release directly or indirectly outside India



# SHREE AJIT PULP AND PAPER LIMITED

Shree Ajit Pulp and Paper Limited ("Company" or "Issuer") was incorporated as 'Shree Ajit Pulp and Paper Private Limited' on March 23, 1995, under the Companies Act, 1956 vide certificate of incorporation issued by the Registrar of Companies, Gujarat, Dadra & Nagar Haveli. Subsequently, our Company was converted into a public limited company and the name of our Company was changed to 'Shree Ajit Pulp and Paper Limited' vide special resolution dated October 15, 1995, vide a fresh certificate of incorporation dated November 13,1995 issued by the Registrar of Companies. Gujarat, Dadra & Nagar Haveli. For further details of the change in name and registered office of our Company, please refer to "General Information" beginning on page 40 of the Letter of Offer.

Registered Office: Survey No. 239, Near Morai Railway Crossing, Village Salvav, Via-Vapi, Valsad - 396191, Gujarat, India. Telephone: +91 260 6635700 | E-mail id: investors@shreeajit.com | Website: www.shreeajit.com

Contact person: Shanoo Mathew Karikkamppally, Company Secretary & Compliance Officer OUR PROMOTERS: GAUTAM SHAH, SURESH SHAH, BELA SHAH AND SUNITA SHAH

ISSUE OF UP TO 35,71,133 PARTLY PAID-UP EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH OF OUR COMPANY ( "RIGHTS EQUITY SHARES") FOR CASH AT A PRICE OF ₹80 EACH (INCLUDING A PREMIUM OF ₹70 PER RIGHTS EQUITY SHARE), AGGREGATING UPTO ₹ 2,856.91 LAKHS" ON A RIGHTS BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 2 (TWO) EQUITY SHARE FOR EVERY 3 (THREE) FULLY PAID-UP EQUITY SHARES HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON THURSDAY, JANUARY 18, 2024 (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS 8 (EIGHT) TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, PLEASE REFER TO THE CHAPTER TITLED "TERMS OF THE ISSUE" ON PAGE 165 OF THE LETTER OF OFFER.

\*Assuming full subscription and receipt of all Call Monies with respect to Right Shares

Amount naughle and Diable Coulty Chares	PAYMENT SCHEDULE			
Amount payable per Rights Equity Share*	Face Value (₹)	Premium (₹)	Total (₹)	
On Application	6	42	48	
On First and Final Call*	4	28	32	
Total (₹)	10	70	80	

\*For further details on the Payment Schedule, see "Terms of the Issue" beginning on page 165 of the Letter of Offer.

\*To be paid at such time as may be determined by the Board at its sole discretion.

# BASIS OF ALLOTMENT

The Board of Directors of our Company thanks all Investors for their response to the Issue, which opened for subscription on Tuesday, January 30, 2024, and closed on Tuesday, February 20, 2024, and the last date for On Market Renunciation of Rights Entitlements was Thursday, February 15, 2024. Out of the total 2,139 Applications for 84,26,829 Rights Equity Shares, 766 Applications for 1,95,359 Rights Equity Shares were rejected due to technical reasons as disclosed in the Letter of Offer. The total number of valid Applications received was 1,373 for 82,31,470 Rights Equity Shares, which was 230.50% of the number of Rights Equity Shares Allotted under the Issue. In accordance with the Letter of Offer and the Basis of Allotment finalized on February 23, 2024, in consultation with BSE Limited ("BSE"), the Designated Stock Exchange, the Lead Manager to the Issue and the Registrar to the Issue. The Rights Issue Committee of the Company, pursuant to the delegation of authority to the Rights Issue Committee by the Board of Directors at their meeting held on February 26, 2024 approved the allotment of 35,71,133 partly paid up Rights Equity Shares to the successful Applicants. In the Issue, no Rights Equity Shares have been kept in abeyance. All valid Applications after the rejection of bids received from non-Eligible Shareholders and technical rejections have been considered for Allotment.

1. The breakup of valid applications received (after the rejection of bids received from non-Eligible Shareholders technical rejections) is given below:

Category	No. of valid applications received	No. of Rights Equity Shares accepted and allotted against Entitlements (A)	No. of Rights Equity Shares accepted and allotted against Additional Rights Equity Shares applied (B)	Total Rights Equity Shares accepted and alloted (A+B)
Shareholders	1,241	31,91,168	2,76,222	34,67,390
Renouncees	132	1,03,743	7 7 77 2	1,03,743
Total	1.373	32.94.911	2.76.222	35.71.133

2. Information renarding total Applications received:

Coloron	Applications Received		Equity Shares Applied for			Equity Shares allotted		
Category	Number	%	Number	Value (Rs.)	%	Number	Value (Rs.)	%
Shareholders	2,007	93.83%	80,99,947	38,87,97,456	96.13	34,67,390	16,64,34,720	97.10
Renouncees	132	6.17%	3,26,882	1,56,90,336	3.87	1,03,743	49,79,664	2.90
Total	2139	100.00%	84,26,829	40,44,87,792	100.00%	35,71,133	17,14,14,384	100.00%

Information for Allotment/refund/rejected cases: The dispatch of Allotment Advice cum Refund Intimation to the investors, as applicable, has been completed on March 1, 2024. The instructions for unblocking funds in case of ASBA Applications were issued to SCSBs on February 23, 2024. The listing application was executed with BSE Limited ("BSE") on February 27, 2024. The credit of Rights Equity Shares to the respective demat accounts of the allottees in respect of Allotment in dematerialized form has been completed on March 1, 2024. For further details, see "Terms of the Issue - Allotment Advice or Refund / Unblocking of ASBA Accounts" on page 165 of the Letter of Offer. The trading in Right Equity Shares issued in the Rights Issue shall commence on Stock Exchanges upon receipt of trading permission. The trading is expected to commence on or before March 7, 2024. Further, in accordance with the SEBI master circular bearing reference - SEBI/HO/CFD/PoD-2/P/ CIR/2023/00094 dated June 21, 2023, the request for extinguishment of Rights Entitlements has been sent to NSDL & CDSL on February 28, 2024.

INVESTORS MAY PLEASE NOTE THAT THE EQUITY SHARES CAN BE TRADED ON THE STOCK EXCHANGES ONLY IN DEMATERIALIZED FORM.

DISCLAIMER CLAUSE OF SEBI: It is to be distinctly understood that the submission of the Letter of Offer to SEBI should not, in any way deemed or construed that the Letter of Offer has been cleared or approved by SEBI. The Investors are advised to refer to the Letter of Offer for the full text of disclaimer clause of the SEBI under the heading "Other Regulatory and Statutory Disclosures - Disclaimer Clause of SEBI" on page 158 of the Letter of Offer.

DISCLAIMER CLAUSE OF BSE (THE DESIGNATED STOCK EXCHANGE): It is to be distinctly understood that the permission given by BSE Limited should not in any way, be deemed or construed that the Letter of Offer has been cleared or approved by the BSE Limited, nor does it certify the correctness or completeness of any of the contents of the Letter of Offer. The Investors are advised to refer to the Letter of Offer for the full text of disclaimer clause of the BSE Limited under the heading "Other Regulatory and Statutory Disclosures - Disclaimer Clause of BSE" on page 161 of the Letter of Offer.

Unless otherwise specified, all capitalised terms used herein shall have the same meaning ascribed to such terms in the Letter of Offer. THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES OR THE COMPANY'S

VIVRO Vivro Financial Services Private Limited Vivro House, 11, Shashi Colony, Opp. Suvidha

LEAD MANAGER TO THE ISSUE

Shopping Centre, Paldi, Ahmedabad - 380 007, Gujarat, India. Telephone: +91-79-4040 4242 E-mail: investors@vivro.net Website: www.vivro.net

Investor Grievance E-mail: investors@vivro.net Contact Person: Kruti Saraiya/ Jay Dodiya SEBI Registration No.: INM000010122

REGISTRAR TO THE ISSUE **LINK**Intime

Link Intime India Private Limited C 101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West). Mumbai - 400083, Maharashtra, India. Telephone: +91 810 811 4949 Email: ajitPrightsissue@linkintime.co.in Website: www.linkintime.co.in Investor Grievance E-mail: aiitPrightsissue@linkintime.co.in Contact Person: Sumeet Deshpande

SEBI Registration No.: INR000004058

**COMPANY SECRETARY AND** COMPLIANCE OFFICER

Shree Ajit Pulp and Paper Limited Mr. Shanoo Mathew Karikkamppally, Survey No. 239, Near Morai Railway Crossing, Village Salvav, Via-Vapi, Valsad - 396191,

Guiarat India. Telephone: +91 260 6635700 E-mail: investors@shreeajit.com Website: www.shreeajit.com

Investors may contact the Registrar or our Compliance Officer for any pre-Issue/post-Issue related matter. All grievances relating to the ASBA process may be addressed to the Registrar, with a copy to the SCSBs, giving full details such as name, address of the Applicant, contact number(s), e-mail ID of the sole/ first holder, folio number or demat account number, serial number of the Application Form, number of Rights Equity Shares applied for, amount blocked, ASBA Account number and the Designated Branch of the SCSBs where the Application Form, or the plain paper application, as the case may be, was submitted by the ASBA Investors along with a photocopy of the acknowledgement slip. For details on the ASBA process, see "Terms of the Issue" on page 165 of the Letter of Offer.

For SHREE AJIT PULP AND PAPER LIMITED

Date: March 2, 2024 Place: Vapi

Sd/-Shanoo Mathew Company Secretary & Compliance Officer

Disclaimer: Our Company is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to issue Equity Shares on a rights basis and has filed a Letter of Offer with the Securities and Exchange Board of India and Stock Exchange. The Letter of Offer is available on the website of SEBI at www.sebi.gov.in, website of Stock Exchange where the Equity Shares are listed i.e. BSE at www.bseindia.com and the website of the Lead Manager at www.vivro.net. Investors should note that investment in equity shares involves a high degree of risk and are requested to refer to the Letter of Offer including the section "Risk Factors" beginning on page 22 of the Letter of Offer. This announcement does not constitute an offer of Rights Equity Shares for sale in any jurisdiction, including the United States, and any Rights Equity Shares described in this announcement may not be offered or sold in the United States absent registration under the US Securities Act of 1933, as amended, or an exemption from registration. There will be no public offering of Rights Equity Shares in the United States.



THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY AND IS NOT A PROSPECTUS ANNOUNCEMENT. THIS DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES. THIS PUBLIC ANNOUNCEMENT IS NOT INTENDED FOR PUBLICATION OR DISTRIBUTION, DIRECTLY OR INDIRECTLY OUTSIDE INDIA.



# PRATHAM EPC PROJECTS LIMITED

Corporate Identity Numbers: U45200GJ2014PLC081119

Our Company was originally incorporated as "Pratham EPC Projects Private Limited" as a private limited company under the provisions of the Companies Act, 2013 vide Certificate of Incorporation dated October 27, 2014 from the Registrar of Companies, Gujarat, Dadra and Nagar Havelli. Further, our Company was converted from private limited company to public limited company pursuant to special resolution passed in the Extra-Ordinary General Meeting of the company dated July 21, 2023 and consequently, the name of our Company was changed to "Pratham EPC Projects Limited" and a fresh certificate of incorporation dated July 28, 2023 was issued to our Company by the Registrar of Companies, Ahmedabad. The Corporate Identification Number of our Company is U45200GJ2014PLC081119.

Registered Office: A-1101, Sankalp Iconic Tower, Opp. Vikramnagar Colony, Iscon Cross Road, S.G. Highway, Ambli, Ahmedabad, Daskroi, Gujarat-380058; Website: www.prathamepc.com; E-Mail: cs@prathamepc.com; Telephone No: 079-4003 7008 Company Secretary and Compliance Officer: Ms. Bhavasthi Rahul Mehta

The Issue is being made in accordance with Chapter IX of the SEBI ICDR Regulations (IPO of Small and Medium Enterprises) and the equity shares are proposed to be listed on Emerge Platform of NSE

## PROMOTERS OF OUR COMPANY: MR. NAYANKUMAR MANUBHAI PANSURIYA AND MR. PRATIKKUMAR MAGANLAL VEKARIYA

Based at Ahmedabad, Pratham EPC Projects Limited is an integrated engineering, procurement, construction and commissioning company being in business of end-to end service providers to Oil & Gas distribution companies in India.

### THE ISSUE

INITIAL PUBLIC ISSUE OF 4800000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH OF PRATHAM EPC PROJECTS LIMITED ("PEPL" OR THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ [+]/- PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ [+]/- PER EQUITY SHARE (THE "ISSUE PRICE") AGGREGATING TO ₹ [•] LAKHS ("THE ISSUE"), OF WHICH 240000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH FOR CASH AT A PRICE OF ₹ [•]/- PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ [+]/- PER EQUITY SHARE AGGREGATING TO ₹ [+] LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTION BY MARKET MAKER TO THE ISSUE (THE "MARKET MAKER RESERVATION PORTION"). THE ISSUE LESS THE MARKET MAKER RESERVATION PORTION i.e. NET ISSUE OF 4560000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH AT A PRICE OF ₹ [•]/- PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ [•]/- PER EQUITY SHARE AGGREGATING TO ₹ [•] LAKHS IS HEREIN AFTER REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE 27.03% AND 25.68%. RESPECTIVELY, OF THE POST ISSUE PAID UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY. THE FACE VALUE OF THE EQUITY SHARES IS ₹ 10/- EACH.

Price Band: ₹ 71/- to ₹ 75/- per Equity Share of Face Value ₹ 10/- each. The Floor Price is 7.1 times of the Face Value and the Cap Price is 7.5 times of the Face Value. Bids can be made for a minimum of 1600 Equity Shares and in multiples of 1600 Equity Shares thereafter

	BID / ISSUE	PROGRAM	
ANCHOR	INVESTORS	Thursday, March 07, 2024	
Bid Opening Date	Monday, March 11, 2024	Initiation of Unblocking of Funds/refunds (T +2 Days)	On or before Friday, March 15, 2024
Bid Closing Date (T day)	Wednesday, March 13, 2024	Credit of Equity Shares to demat accounts of Allotees (T +2 Days)	On or before Friday, March 15, 2024
Finalization of basis of allotment with the Designated Stock Exchange/ Allotment of Securities (T +1 Day)	On or before Thursday, March 14, 2024	Commencement of Trading of Equity Shares on the Stock Exchanges/Listing Date (T + 3 Days)	On or before Monday, March 18, 2024

**CORRIGENDUM TO RED HERRING PROSPECTUS DATED MARCH 01, 2024** NOTICE TO THE INVESTORS ("THE CORRIGENDUM")

This corrigendum cum Addendum is with reference to the Red Herring Prospectus Dated March 01, 2024 In this regard, please note the following:

## SECTION IV - INTRODUCTION

	THE ISSUE
	Present Issue in terms of this Red Herring Prospectus:
Particulars	Details
Equity Shares Issued*	Issue 4800000 Equity Shares of ₹ 10/- each at a price of ₹ [•]/- per Equity Share each aggregating to ₹ [•] Lakhs
Of which;	Issue 4800000 Equity Shares of ₹ 10/- each at a price of ₹ [+]/- per Equity Share each aggregating to ₹ [+] Lakhs
Reserved for Market Makers	240000 Equity Shares of ₹ 10/- each at an Issue Price of ₹ [•]/- per Equity Share each aggregating to ₹ [•] Lakhs
Net Issue to the Public	4560000 Equity Shares of ₹ 10/- each at an Issue Price of ₹ [•]/- per Equity Share each aggregating to ₹ [•] Lakhs
Of which	
Allocation to Qualified Institutional Buyers	Not more than 2278400 Equity Shares of ₹ 10/- each at an Issue Price of ₹ [•]/- per Equity Share each aggregating to ₹ [•] Lakhs
Of which	
Anchor Investors	Upto 1366400 Equity Shares of ₹ 10/- each at an Issue Price of ₹ [•]/- per Equity Share each aggregating to ₹ [•] Lakhs
Net QIB Portion (Assuming Anchor allocation portion is fully subscribed)	Upto 912000 Equity Shares of ₹ 10/- each at an Issue Price of ₹ [•]/- per Equity Share each aggregating to ₹ [•] Lakhs
Of which	
Available for allocation to Mutual Fundsonly (5% of the QIB portion excluding Anchor Investor Portion)	[•] Equity Shares of ₹ 10/- each at an Issue Price of ₹ [•]/- per Equity Share each aggregating to ₹ [•] Lakhs

Balance QIB Portion for all [•] Equity Shares of ₹ 10/- each at an Issue Price of ₹ [•]/- per Equity Share each aggregating to ₹ [•] Lakhs QIBs including Mutual Funds Not less than 684800 Equity Shares of ₹ 10/- each at an Issue Price of ₹ [+]/- per Equity Share each aggregating to ₹ Allocation to Non-Institutional Investors [ • ] Lakhs Not less than 1596800 Equity Shares of ₹ 10/- each at an Issue Price of ₹ [•]/- per Equity Share each aggregating to ₹ Allocation to Retail Individual Investors [•] Lakhs Equity Shares outstanding 12960000 Equity Shares of ₹ 10/- each prior to the Issue Equity Shares outstanding 17760000 Equity Shares of ₹ 10/- each

BOOK RUNNING LEAD MANAGER TO THE ISSUE

after the Issue

Use of Proceeds

BEELI///E

BEELINE CAPITAL ADVISORS PRIVATE LIMITED

SEBI Registration Number: INM000012917 Address: B 1311-1314, Thirteenth Floor, Shilp Corporate Park, Raipath Rangoli Road, Thaltei, Ahmadabad, Gujarat - 380054, India. Telephone Number: 079 4918 5784 Email Id: mb@beelinemb.com Investors Grievance Id: ig@beelinemb.com Website: www.beelinemb.com Contact Person: Mr. Nikhil Shah CIN: U67190GJ2020PTC114322

REGISTRAR TO THE ISSUE

**LINK**Intime

information on use of Issue Proceeds.

For details, please refer chapter titled "Objects of The Issue" beginning on Page no. 88 of this Red Herring Prospectus for

LINK INTIME INDIA PRIVATE LIMITED SEBI Registration Number: INR000004058 Address: C-101, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai - 400083, Maharashtra, India. Tel. Number: +91 22 4918 6200 Fax- 022 - 4918 6060 Email Id: prathamepc.jpo@linkintime.co.in Investors Grievance Id: prathamepc.ipo@linkintime.co.in

Website: www.linkintime.co.in Contact Person: Shanti Gopalkrishnan CIN: U67190MH1999PTC118368

COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER



Address: A-1101, Sankalp Iconic Tower, Opp. Vikramnagar Colony, Iscon Cross Road, S.G. Highway, Ambli, Ahmedabad, Daskroi, Gujarat-380058. Tel No: 079- 4003 7008; Contact person: Ms. Bhavasthi Rahul Mehta Email: cs@prathamepc.com

Website: www.prathamepc.com Investors can contact the Company Secretary and Compliance Officer or the BRLMs or the Registrar to the Issue in case of any pre-Issue or post-issue related problems, such as non-receipt of letters of Allotment, noncredit of Allotted Equity Shares in the respective

beneficiary account and refund orders, etc.

On behalf of Board of Directors For, PRATHAM EPC PROJECTS LIMITED

Mr. Pratikkumar Maganlal Vekariya

Place: Ahmedabad Dated: March 02, 2024

Chairman and Managing Director Disclaimer: Pratham EPC Projects Limited is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals market conditions and other considerations, to make an initial public issue of its Equity Shares and has filed the RHP with the Registrar of Companies Ahmedabad on March 01, 2024 and thereafter with SEBI and the Stock Exchanges. The RHP is available on the websites of SEBI at www.sebi.gov.in. website of the Company at www.prathamepc.com, the website of the BRLM to the Issue at www.beelinemb.com, the website of NSE i.e www.nseindia.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, please refer to the RHP including the section titled "Risk Factors" beginning on page 31 of the Red Herring Prospectus.

The Equity Shares have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the "Securities Act") or any state securities laws in the United States, and unless so registered, and may not be issued or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act and in accordance with any applicable U.S. state securities laws. The Equity Shares are being Offered and sold outside the United States in 'offshore transactions' in reliance on Regulation S under the Securities Act and the applicable laws of each jurisdiction where such Offers and sales are made. There will be no public offering in the United States.

Ahmedabad

# लापता नाविक के परिवार ने सीबीआइ जांच की मांग की

जम्मू, ३ मार्च (भाषा) ।

हफ्ते भर से लापता नौसेना के नाविक साहिल वर्मा के माता-पिता ने भारतीय नौसेना के एक जहाज से समुद्र में रहस्यमय रूप से उनके लापता होने के लिए जिम्मेदार रही परिस्थितियों की केंद्रीय अन्वेषण ब्यूरो (सीबीआइ) से जांच कराने की रविवार को मांग की। वर्मा 27 फरवरी को नौसेना के एक जहाज से लापता हो गए थे और उनका पता लगाने के लिए एक व्यापक तलाश अभियान शुरू किया गया।

जम्मू के घोउ मन्हासन इलाके में रहने वाले उनके पिता सुभाष चंद्र और मां रमा कुमारी ने अपने लापता बेटे की सुरक्षित वापसी सुनिश्चित करने के लिए प्रधानमंत्री नरेन्द्र मोदी, रक्षा मंत्री राजनाथ सिंह, गृह मंत्री अमित शाह और जम्मू-कश्मीर के उपराज्यपाल मनोज सिन्हा से हस्तक्षेप की मांग की है। वर्मा के पिता ने एजंसी को दिए साक्षात्कार में कहा कि यह आश्चर्यजनक है कि एक सैनिक नौसेना के अपने जहाज से लापता हो गया और उसका पता नहीं चल पा रहा है। मुझे बताया गया है। कि जहाज पर लगे सीसीटीवी कैमरों में किसी को भी समुद्र में गिरते हुए नहीं देखा गया। फिर मेरा बेटा कहां है।

नाविक के लापता होने को 'दुर्भाग्यपूर्ण' बताते हुए पश्चिमी नौसेना कमान ने कहा कि

"TERMS OF THE ISSUE" ON PAGE 165 OF THE LETTER OF OFFER.

Amount payable per Rights Equity Share\*

On Application

Total (₹)

On First and Final Call®

Category

Category

BUSINESS PROSPECTS.

Gujarat, India.

LEAD MANAGER TO THE ISSUE

VIVRO

Vivro Financial Services Private Limited

Vivro House, 11, Shashi Colony, Opp. Suvidha

Shopping Centre, Paldi, Ahmedabad - 380 007,

Investor Grievance E-mail: investors@vivro.net

Contact Person: Kruti Saraiya/ Jay Dodiya

SEBI Registration No.: INM000010122

Telephone: +91-79-4040 4242

E-mail: investors@vivro.net

Website: www.vivro.net

Date: March 2, 2024

Place: Vapi

Shareholders

Renouncees

Shareholders

Renouncees

Total

\*Assuming full subscription and receipt of all Call Monies with respect to Right Shares

\* To be paid at such time as may be determined by the Board at its sole discretion.

non-Eligible Shareholders and technical rejections have been considered for Allotment.

No. of valid applications

received

1.241

1.373

2. Information regarding total Applications received:

132

**Applications Received** 

93.83%

6.17%

heading "Other Regulatory and Statutory Disclosures - Disclaimer Clause of SEBI" on page 158 of the Letter of Offer.

Regulatory and Statutory Disclosures - Disclaimer Clause of BSE" on page 161 of the Letter of Offer.

100.00%

Number

2.007

132

2139



साहिल वर्मा २७ फरवरी को नौसेना के एक जहाज से लापता हो गए थे और उनका पता लगाने के लिए एक व्यापक तलाश अभियान शुरू किया गया।

उच्चस्तरीय जांच का आदेश दिया गया है। इसने शनिवार को 'एक्स' पर पोस्ट किया कि एक दुर्भाग्यपूर्ण घटना में, नाविक साहिल वर्मा के 27 फरवरी, 2024 से भारतीय नौसेना के जहाज से समुद्र में लापता होने की सूचना मिली। नौसेना ने तुरंत जहाजों और विमानों के साथ व्यापक स्तर पर खोजबीन अभियान शुरू किया, जो अभी भी जारी है। नाविक के पिता ने कहा कि हम चाहते हैं कि सरकार गहन

जांच के लिए मामले को सीबीआइ को सौंप दे।

(This is an Advertisement for information purposes only and not for publication or distribution or release directly or indirectly outside India and is not an offer document announcement)

Shree Ajit Pulp and Paper Limited ("Company" or "Issuer") was incorporated as 'Shree Ajit Pulp and Paper Private Limited' on March 23, 1995, under the Companies

Act, 1956 vide certificate of incorporation issued by the Registrar of Companies, Gujarat, Dadra & Nagar Haveli. Subsequently, our Company was converted into a

public limited company and the name of our Company was changed to 'Shree Ajit Pulp and Paper Limited' vide special resolution dated October 15, 1995, vide a fresh

certificate of incorporation dated November 13,1995 issued by the Registrar of Companies, Gujarat, Dadra & Nagar Haveli. For further details of the change in name

Registered Office: Survey No. 239, Near Morai Railway Crossing, Village Salvay, Via-Vapi, Valsad - 396191, Gujarat, India.

Telephone: +91 260 6635700 | E-mail id: investors@shreeajit.com | Website: www.shreeajit.com

Contact person: Shanoo Mathew Karikkamppally, Company Secretary & Compliance Officer

OUR PROMOTERS: GAUTAM SHAH. SURESH SHAH. BELA SHAH AND SUNITA SHAH

ISSUE OF UP TO 35.71.133 PARTLY PAID-UP EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH OF OUR COMPANY ("RIGHTS EQUITY SHARES") FOR CASH AT

A PRICE OF ₹80 EACH (INCLUDING A PREMIUM OF ₹70 PER RIGHTS EQUITY SHARE). AGGREGATING UPTO ₹ 2,856.91 LAKHS" ON A RIGHTS BASIS TO THE

ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 2 (TWO) EQUITY SHARE FOR EVERY 3 (THREE) FULLY PAID-UP EQUITY SHARES HELD

BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON THURSDAY, JANUARY 18, 2024 (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE

RIGHTS EQUITY SHARES IS 8 (EIGHT) TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, PLEASE REFER TO THE CHAPTER TITLED

Face Value (₹)

6

10

BASIS OF ALLOTMENT

The Board of Directors of our Company thanks all Investors for their response to the Issue, which opened for subscription on Tuesday, January 30, 2024, and closed on Tuesday, February 20, 2024, and the last date for On Market Renunciation of Rights Entitlements was Thursday, February 15, 2024. Out of the total 2,139 Applications

for 84,26,829 Rights Equity Shares, 766 Applications for 1,95,359 Rights Equity Shares were rejected due to technical reasons as disclosed in the Letter of Offer. The

total number of valid Applications received was 1,373 for 82,31,470 Rights Equity Shares, which was 230,50% of the number of Rights Equity Shares Allotted under

the Issue. In accordance with the Letter of Offer and the Basis of Allotment finalized on February 23, 2024, in consultation with BSE Limited ("BSE"), the Designated

Stock Exchange, the Lead Manager to the Issue and the Registrar to the Issue. The Rights Issue Committee of the Company, pursuant to the delegation of authority

to the Rights Issue Committee by the Board of Directors at their meeting held on February 26, 2024 approved the allotment of 35,71,133 partly paid up Rights Equity

Shares to the successful Applicants. In the Issue, no Rights Equity Shares have been kept in abeyance. All valid Applications after the rejection of bids received from

**Equity Shares Applied for** 

Value (Rs.)

38,87,97,456

1.56.90.336

40.44.87.792

Information for Allotment/refund/rejected cases: The dispatch of Allotment Advice cum Refund Intimation to the investors, as applicable, has been completed on

March 1, 2024. The instructions for unblocking funds in case of ASBA Applications were issued to SCSBs on February 23, 2024. The listing application was executed

with BSE Limited ("BSE") on February 27, 2024. The credit of Rights Equity Shares to the respective demat accounts of the allottees in respect of Allotment in

dematerialized form has been completed on March 1, 2024. For further details, see "Terms of the Issue - Allotment Advice or Refund / Unblocking of ASBA Accounts"

on page 165 of the Letter of Offer. The trading in Right Equity Shares issued in the Rights Issue shall commence on Stock Exchanges upon receipt of trading permission.

The trading is expected to commence on or before March 7, 2024. Further, in accordance with the SEBI master circular bearing reference - SEBI/HO/CFD/PoD-2/P/

DISCLAIMER CLAUSE OF SEBI: It is to be distinctly understood that the submission of the Letter of Offer to SEBI should not, in any way deemed or construed that the

Letter of Offer has been cleared or approved by SEBI. The Investors are advised to refer to the Letter of Offer for the full text of disclaimer clause of the SEBI under the

DISCLAIMER CLAUSE OF BSE (THE DESIGNATED STOCK EXCHANGE): It is to be distinctly understood that the permission given by BSE Limited should not in any

way, be deemed or construed that the Letter of Offer has been cleared or approved by the BSE Limited, nor does it certify the correctness or completeness of any of the

contents of the Letter of Offer. The Investors are advised to refer to the Letter of Offer for the full text of disclaimer clause of the BSE Limited under the heading "Other

THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES OR THE COMPANY'S

REGISTRAR TO THE ISSUE

**LINK**Intime

Link Intime India Private Limited

Mumbai - 400083, Maharashtra, India.

Email: ajitPrightsissue@linkintime.co.in

Telephone: +91 810 811 4949

Website: www.linkintime.co.in

aiitPrightsissue@linkintime.co.in

Contact Person: Sumeet Deshpande

SEBI Registration No.: INR000004058

Investors may contact the Registrar or our Compliance Officer for any pre-Issue/post-Issue related matter. All grievances relating to the ASBA process may be addressed

to the Registrar, with a copy to the SCSBs, giving full details such as name, address of the Applicant, contact number(s), e-mail ID of the sole/ first holder, folio

number or demat account number, serial number of the Application Form, number of Rights Equity Shares applied for, amount blocked, ASBA Account number and the

Designated Branch of the SCSBs where the Application Form, or the plain paper application, as the case may be, was submitted by the ASBA Investors along with a

Investor Grievance E-mail:

photocopy of the acknowledgement slip. For details on the ASBA process, see "Terms of the Issue" on page 165 of the Letter of Offer.

C 101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West),

1. The breakup of valid applications received (after the rejection of bids received from non-Eligible Shareholders technical rejections) is given below:

No. of Rights Equity Shares

accepted and allotted against

Entitlements (A)

Number

80.99.947

3.26.882

84,26,829

CIR/2023/00094 dated June 21, 2023, the request for extinguishment of Rights Entitlements has been sent to NSDL & CDSL on February 28, 2024.

INVESTORS MAY PLEASE NOTE THAT THE EQUITY SHARES CAN BE TRADED ON THE STOCK EXCHANGES ONLY IN DEMATERIALIZED FORM.

Unless otherwise specified, all capitalised terms used herein shall have the same meaning ascribed to such terms in the Letter of Offer.

31,91,168

1,03,743

32,94,911

and registered office of our Company, please refer to "General Information" beginning on page 40 of the Letter of Offer.

\*For further details on the Payment Schedule, see "Terms of the Issue" beginning on page 165 of the Letter of Offer.

REE AJIT PULP AND PAPER LIMITED

PAYMENT SCHEDULE

Premium (₹)

42

28

70

No. of Rights Equity Shares accepted

and allotted against Additional Rights

Equity Shares applied (B)

96.13

3.87

100.00%

2.76.222

2.76,222

Number

34.67.390

1.03.743

जम्मू-कश्मीर पुलिस बेहतर संतुलन के साथ काम कर रही है : सिन्हा

श्रीनगर, 3 मार्च (भाषा) ।

जम्म कश्मीर के उपराज्यपाल मनोज सिन्हा ने रविवार को कहा कि केंद्रशासित प्रदेश की पुलिस देश का एकमात्र बल है जिसने नियमित पुलिस कर्तव्यों और नागरिक गतिविधियों के बीच बेहतर संतुलन बनाया है।

सिन्हा ने यहां डल झील के तट पर 23वीं अखिल भारतीय पुलिस जल खेल चैंपियनशिप के उद्घाटन के मौके पर कहा कि जम्मू-कश्मीर पुलिस देश का एकमात्र ऐसा बल है जिसने आतंकवाद रोधी अभियानों, सामान्य पुलिस कर्तव्यों, खेल गतिविधियों और नागरिक कार्यक्रमों के बीच एक बेहतर संतुलन बनाया है। उन्होंने कहा कि मैं जम्मू-कश्मीर के उन पुलिसकर्मियों को अपनी विनम्र श्रद्धांजिल अर्पित करता हुं जिन्होंने सर्वोच्च बलिदान दिया है।

सिन्हा ने उम्मीद जताई कि चैंपियनशिप में हिस्सा लेने के लिए यहां एकत्र हुए पुलिस और अर्धसैनिक बल के जवान जम्मू-कश्मीर के 'ब्रांड एंबेसडर' के रूप में अपने घर लौटेंगे।

जिन लोगों ने राम मंदिर के निमंत्रण को अस्वीकार किया. उन्हें चुनाव में नकार दिया जाएगा : मौर्य भोपाल, ३ मार्च (भाषा) ।

उत्तर प्रदेश के उपमुख्यमंत्री केशव प्रसाद मौर्य ने रविवार को रीवा और सतना में भाजपा कार्यकर्ताओं के सम्मेलन में कांग्रेस पर निशाना साधते हए कहा कि जिन लोगों ने अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा समारोह में भाग लेने का निमंत्रण अस्वीकार कर दिया. उन्हें लोकसभा चुनाव में जनता नकार

Total (₹)

48

32

80

Total Rights Equity

Shares accepted and

alloted (A+B)

34.67.390

1,03,743

35,71,133

97.10

2.90

100.00%

**Equity Shares allotted** 

COMPANY SECRETARY AND

COMPLIANCE OFFICER

Shree Ajit Pulp and Paper Limited

Village Salvav, Via-Vapi, Valsad - 396191,

Survey No. 239, Near Morai Railway Crossing,

Mr. Shanoo Mathew Karikkamppally,

Telephone: +91 260 6635700

Website: www.shreeajit.com

E-mail: investors@shreeajit.com

Guiarat, India.

35.71.133 17.14.14.384

Value (Rs.)

16.64.34.720

49.79.664

फॉर्म नंबर आईएनसी —26 (कंपनियों के नियम 30 के अनुसार (निगमन) नियम, 2014) केंद्र सरकार के क्षेत्रीय निदेशक के समक्ष, उत्तरी क्षेत्र

कंपनी अधिनियम, 2013 की धारा 13 की उप-धारा (4) और कंपनी (निगमन) नियम, 2014 के नियम 30 के उप-नियम (5) के खंड (ए) के मामले में

अकिला टेक्नोलॉजीज एंड इंटीग्रेशन सॉल्यूशंस प्राइवेट लिमिटेड के मामले में (सीआईएन U74999DL2019PTC345452) इसक पंजीकृत कार्यालय ई-18, तीसरी मंजिल एनडीएसई, न्यू दिल्ली-110049 में है

कंपनी अधिनियम, 2013 की धारा 13(4) के तहत पारि विशेष संकल्प के संदर्भ में कंपनी के मेमोरेंडम ऑ एसोसिएशन में बदलाव की पुष्टि के लिए केंद्र सरकार व आवेदन करने का प्रस्ताव करती है। सोमवार, 12 फरवर्र 2024 को आयोजित असाधारण आम बैठक में कंपनी अप पंजीकृत कार्यालय को 'राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली'

कोई भी व्यक्ति जिसका हित कंपनी के पंजीकृत कार्याल के प्रस्तावित परिवर्तन से प्रभावित होने की संभावना है, व एमसीए—21 पोर्टल (www.mca.gov.in) पर निवेशव शिकायत फॉर्म दाखिल करके या डिलीवरी या भेजने क कारण बन सकता है। अपनी आपत्तियों को क्षेत्रीय निदेशक उत्तरी क्षेत्र पीठ, नई दिल्ली, बी-2 विंग, द्वितीय तल, दीनदयाल अंत्योदय भवन, सीजीओ कॉम्प्लेक्स, नई दिल्ली – 110003 को अपनी रुचि की प्रकृति और विरोध व आधार बताते हुए एक हलफनामे के साथ पंजीकृत डाक र जि। इस नोटिस के प्रकाशन की तारीख से चौदह दि के भीतर आवेदक कंपनी की एक प्रति के साथ उसवं पंजीकृत कार्यालय, ई-18, तीसरी मंजिल, एनडीएसई, न दिल्ली — 110049 पर जमा करें।

आवेदक के लिए और उसकी ओर र अकिला टेक्नोलॉजीज एंड इंटीग्रेशन सॉल्यशंस प्राइवेत हस्ता/-

अजय राठौर निदेशव स्थानः नई दिल्ली डीआईएन:08351802

फॉर्म नं. आईएनसी–26 [कंपनी (निगमन) नियम 2014 के नियम 30 के अनुसार।

दसरे राज्य में बदलने के लिए समाचार पत्र में प्रकाशित किया जाना वाला विज्ञापन केंद्र सरकार के समक्ष उत्तरी क्षेत्र कंपनी अधिनियम, 2013 की धारा 13 की उप-धारा (4) और कंपनी (निगमन) नियम, 2014 के नियम 30 के उप-नियम (5) के खंड (ए) के मामले में

कंपनी के पंजीकृत कार्यालय को एक राज्य से

काशीपुर इंफ्रास्ट्रक्चर एंड फ्रेट टर्मिनल प्राइवेट लिमिटेड के पंजीकृत कार्यालय 206, दूसर मंजिल, डी-2, दक्षिणी पार्क, साकेत जिला केंद्र साकेत. नई दिल्ली-110017 के मामले में:

आम जनता को नोटिस दिया जाता है कि कंपर्न अधिनियम, 2013 की धारा 13 के तहत केंद्र सरका को आवेदन करने का प्रस्ताव करती है. जिसमे एक्स्टा में पारित विशेष प्रस्ताव के संदर्भ में कंपर्न के मेमोरेंडम ऑफ एसोसिएशन में बदलाव की पष्टि की मांग की जाती है। कंपनी को अपने पंजीकृत कार्यालय को 'राष्टीय राजधानी क्षेत्र दिल्ली' 'महाराष्ट राज्य' में बदलने में सक्षम बनाने के लिए सोमवार, फरवरी 19, 2024 को साधारण आम बैठक आयोजित की गई।

कोई भी व्यक्ति जिसका हित कंपनी के पंजीकर कार्यालय के प्रस्तावित परिवर्तन से प्रभावित हो की संभावना है, वह एमसीए-21 पोर्टर (www.mca.gov.in) पर निवेशक शिकायत फॉर्म दाखिल करके या डिलीवरी या भेजने का कारण बन सकता है। अपनी आपत्तियों को क्षेत्रीय निदेशक, उत्तरी क्षेत्र, बी-2 विंग, द्वितीय तल, प दीनदयाल अंत्योदय भवन, सीजीओ कॉम्प्लेक्स, नः दिल्ली-110003 के पते पर अपनी रुचि की प्रकृति और विरोध के आधार बताते हुए एक हलफनामे के साथ पंजीकृत डाक से भेजें। इस नोटिस प्रकाशन की तारीख से चौदह दिनों के भीतर एक प्रति आवेदक कंपनी को उसके पंजीकृत कार्यालय 206, दूसरी मंजिल, डी-2, दक्षिणी पार्क. साकेत जिला केंद्र साकेत, नई दिल्ली–110017 में भेजें। काशीपर इंफ्रास्टक्चर एंड फ्रेट

टर्मिनल प्राइवेट लिमिटेड के लिए और उसकी ओर से दिनांकः 04.03.2024, हस्ता /-स्थानः दिल्ली संविद गुप्ता (निदेशक)

फॉर्म नंबर आईएनसी—26

[कंपनी (निगमन) नियम, 2014 के नियम 30 के कंपनी के पंजीकृत कार्यालय को "राष्ट्रीय राजधानी

क्षेत्र दिल्ली" से "पश्चिम बंगाल राज्य" में बदलने के लिए विज्ञापन केंद्र सरकार के समक्ष / क्षेत्रीय निदेशक, उत्तरी क्षेत्र,

कंपनी अधिनियम, 2013 की धारा 13 की उपधारा (4) और कंपनी (निगमन) नियम 2014 के नियम 30 के उप नियम 5 के खंड (ए) के

एलेकॉम कॉस्मेटिक्स प्राइवेट लिमिटेड (सीआईएन U52312DL2010PTC206893) के मामले में इसका पंजीकृत कार्यालय ए-163/1, यू.जी.एफ बैक साइड, लाडो सराय, दक्षिण दिल्ली, नई दिल्ली 110030 है।

—आवेदक / याचिकाकर्ता आम जनता को सूचित किय जाता है कि कंपनी कंपनी अधिनियम, 2013 की धारा 13 के तहत केंद्र सरकार / क्षेत्रीय निदेशक, उत्तरी क्षेत्र, दिल्ली को आवेदन करने का प्रस्ताव करती है, जिसमें कंपनी के मेमोरेंडम ऑफ एसोसिएशन के नियमों में बदलाव की पृष्टि की मांग की जाती है। 02/01/2024 को आयोजित असाधारण आम बैठक में पारित विशेष प्रस्ताव के तहत कंपनी को अपने पंजीकत कार्यालय को "राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली" से "पश्चिम बंगाल राज्य" बदलने में सक्षम बनाने के लिये की गयी थी।

कोई भी व्यक्ति जिसका हित कंपनी के पंजीकृत कार्यालय के प्रस्तावित परिवर्तन से प्रभावित होने की संभावना है, वह या तो एमसीए-21 पोर्टल (www.mca.gov.in) पर या निवेशक शिकायत फॉर्म दाखिल करके या डिलीवरी या भेजने का कारण बन सकता है। अपनी आपत्तियों को क्षेत्रीय निदेशक, उत्तर्र क्षेत्र को "बी-2 विंग, द्वितीय तल, पं.दीनदयाल अंत्योदय भवन दूसरी मंजिल, सीजीओ कॉम्प्लेक्स, नइ दिल्ली-110003 पते पर अपनी रुचि की प्रकृति और विरोध के आधार बताते हुए एक हलफनामे के साथ पंजीकृत डाक से भेजें।, इस नोटिस के प्रकाशन की तारीख से चौदह दिनों के भीतर आवेदक कंपनी को उसके पंजीकृत कार्यालय ए-163/1, यूजीएफ बैक साइड. लाडो सराय. साउथ दिल्ली. नई दिल्ली 110030

के पते पर एक प्रति के साथ भेजें। ईमेल:suresh jhunjhunwala@bcplindia.com एलेकॉम कॉस्मेटिक्स प्राइवेट लिमिटेड के लिए और उसकी ओर से

हस्ता /-नारायण कूमार बाहेती स्थान : नई दिल्ली निदेशक प्रधानमंत्री मोदी के श्रीनगर दौरे के मद्देनजर सुरक्षाबल सतर्क : प्रधानमंत्री नरेंद्र मोदी के गुरुवार को यहां बख्शी स्टेडियम में एक जनसभा को संबोधित करने के कार्यक्रम के मद्देनजर सुरक्षाबलों को चौकन्ना रहने को कहा गया है। अधिकारियों ने रविवार को बताया कि बख्शी स्टेडियम के आसपास सुरक्षाकर्मियों की तैनाती बढा दी गई है। श्रीनगर(भाषा) ।



टाटा कैपिटल हाउसिंग फाइनेंस लिमिटेड

पंजीकृत कार्यालय : 11वीं मंजिल, टॉवर ए, पेनिनसुला बिजिनेस पार्क, गणपतराव कदम मार्ग, लोअर परेल, मुम्बई-40013 शाखा कार्यालय : टाटा कैपिटल हाउसिंग फाइनेंस लिमिटेड, बी-36, प्रथम एवं द्वितीय तल, लाजपत नगर-भाग 2, एचडीएफसी बैंक के ऊपर, नई दिल्ली-110024

अचल सम्पत्ति की बिक्री हेतु विक्रय सुचना

(प्रतिभृति हित (प्रवर्तन) नियम 2002 के नियम 9(1) के साथ पठित नियम 8(6) के तहत) प्रतिभृति हित (प्रवर्तन) नियम, 2002 के नियम 9(1) एवं नियम 8(6) प्रावधानों के साथ पठित वित्तीय आस्तियों के प्रतिभृतिकरण एवं

पुनर्निर्माण तथा प्रतिभूति हित प्रवर्तन अधिनियम, 2002 के तहत अचल आस्तियों की बिक्री हेतु ई-नीलामी बिक्री सूचना जनसामान्य को और विशेष रूप से निम्नलिखित कर्जदार/सह-कर्जदारों अथवा उनके विधिक उत्तराधिकारियों/प्रतिनिधियों (कर्जदार) को एतद्वारा सचना दी जाती है कि टाटा कैपिटल हाउसिंग फाइनेंस लिमिटेड (टीसीएचएफएल) के पास नीचे वर्णित बंधक अचल सम्पत्ति, जिसका कब्जा टीसीएचएफएल के अधिकृत प्राधिकारी द्वारा कर लिया गया है, कर्जदारों तथा सह-कर्जदारों से कुल राशि की वसली हेतु ''जहाँ है जैसे है'', ''जो है जैसे है'' तथा ''जो भी है वहीं है'' के आधार पर 20.03.2024 को बिक्री की जायेगी। आरक्षित मूल्य तथा धरोहर राशि नीचे उल्लिखित है।

एतद्वारा सूचना दी जाती है कि बिक्री के किसी आस्थगन/असततता की अनुपस्थिति में, आस्ति/सम्पत्ति की बिक्री ई-नीलामी द्वारा **कथित** 20.03.2024 को 2 बजे अप. की जायेगी। ई-नीलामी में भाग लेने हेतु ईएमडी के डिमाण्ड डाफ्ट वाला महरबन्द लिफाफा टीसीएचएफएल के अधिकृत प्राधिकारी के पास शाखा पता टाटा कैपिटल हाउसिंग फाइनेंस लिमिटेड, बी-36, प्रथम एवं द्वितीय तल, लाजपत नगर, भाग-2, एचडीएफसी बैंक के ऊपर, नई दिल्ली-110024 पर 19.03.2024 को 5 बजे अप. तक जमा करना है।

प्रतिभत आस्ति/अचल सम्पत्ति की बिक्री ''जहाँ है जैसे है स्थिति'' में नीचे वर्णित संक्षिप्त विवरणों के अनुसार की जायेगी

क्र.	ऋण खाता	दायित्वधारी( यों )/सह-	माँग सूचना के अनुसार	आरक्षित	जमा धरोहर	कब्जे क
सं.	सं. तथा	कर्जदार( रों )⁄विधिक	बकाया राशि	मूल्य	राशि	प्रकार
	शाखा	उत्तराधिकारी( यों )⁄विधिक				
		प्रतिनिधि( यों ) ⁄ जमानती( यों ) के				
		नाम				
1.	TCHHF	श्री कालू राम ढींगरा पुत्र श्री तुलसी	रु. 26,32,860/- (रुपये छब्बीस लाख बत्तीस	₹.	₹.	भौतिक
	039900 010006	दास	हजार आठ सौ साठ मात्र) आपके द्वारा ऋण	2,37,00,000/-	23,70,000/-	
	7169 तथा	श्री आकाश ढींगरा पुत्र श्री कालूराम	खाता TCHHF0399000100067169 के	(रुपये दो करोड़	(रुपये तेईस	
	TCHHF	धींगरा	तहत देय एवं बकाया है तथा रु.	सैंतीस लाख	लाख सत्तर	
	035000	श्रीमती कविता ढींगरा पत्नी श्री कालू	1,97,87,252/- (रुपये एक करोड़ सत्तानबे	मात्र)	हजार मात्र)	
	010000 7590	राम ढींगरा,	लाख सत्तासी हजार दो सौ बावन मात्र) आपके			
	7590	ढींगरा एसोसिएट्स इसके प्रोपराइटर	द्वारा ऋण खाता सं.			
		के माध्यम से	TCHHF0350000100007590 के तहत			
			देय एवं बकाया है अर्थात कुल रु.			
			2,24,20,112/- (रुपये दो करोड़ चौबीस लाख			
			बीस हजार एक सौ बारह मात्र)			
			05.04.2023			

**अचल संपत्ति का विवरण:** 155.50 वर्ग मीटर क्षेत्रफल वाले आवासीय मकान नंबर 92 के पूरे निर्मित दूसरे तल (छत के अधिकार के बिना) का समस्त भाग, नीचे की भूमि में फ्रीहोल्ड आनुपातिक अधिकार के साथ, शक्ति विहार, पीतमपुरा, रिंम अपार्टमेंट के पास, सरस्वती विहार, उत्तर - पश्चिम दिल्ली, नई दिल्ली - 110001 में स्थित, बिक्री विलेख में उल्लिखित सभी सामान्य सुविधाओं के साथ। मकान नंबर 92 की सीमा इस प्रकार है: पूर्व - मकान नंबर 93, पश्चिम - मकान नंबर 91, उत्तर - सर्विस लेन, दक्षिण-रोड।

नोट : कर्जदार द्वारा टीसीएचएफएल (एसए/510/2023) के विरुद्ध दाखिल एसए डीआरटी-1, दिल्ली के समक्ष लम्बित है। उक्त मामले में टीसीएचएफएल के विरुद्ध कोई स्ट्रे ऑईर पारित नहीं है।

। ।वरु	विरुद्ध काई स्ट आंडर पारित नहां है।								
2.	TCHI	(स्वर्गीय) श्री सुनील बिश्वकर्मा पुत्र	र. 2026995/- (रुपये बीस लाख छब्बीस हजार नौ सौ	₹.	₹.	भौति			
	N039	श्री बिष्णु बिस्वकर्मा - उनके कानूनी	पिचानबे मात्र) आपके द्वारा ऋण खाता सं. 10527116	19,75,000/-	1,97,500/-				
	9000		के तहत देय एवं बकाया है तथा रु. 281417/- (रुपये						
	1000 8237		दो लाख इक्यासी हजार चार सौ सत्रह मात्र) आपके द्वारा						
	6 तथा		ऋण खाता सं. TCHIN0399000100082376 के		हजार पांच सै	t			
	1052	बिश्वकर्मा पत्नी श्री सुनील बिश्वकर्मा	तहत देय एवं बकाया है अर्थात कुल रु. 230841 <i>2/</i> –		मात्र)				
	7116	– कानूनी उत्तराधिकारी, श्री वर्धन	(रुपये तेईस लाख आठ हजार चार सौ बारह मात्र)						
		बिश्वकर्मा पुत्र स्वर्गीय श्री सुनील	13-04-2022						
		बिश्वकर्मा –कानूनी उत्तराधिकारी	13 04-2022						

**अचल संपत्ति का विवरण**: संपत्ति संख्या 17 के निर्मित ऊपरी भूतल (सामने की ओर) का समस्त भाग, छत के अधिकार के बिना, क्षेत्रफल 43.4772 वर्ग मीटर (52 वर्ग गज), खसरा संख्या 299 में निर्मित, ग्राम नसीरपुर की राजस्व संपदा में स्थित, इलाका सागरपुर पश्चिम, नई दिल्ली - 110046, बिक्री विलेख में लिखी गई सभी सामान्य सविधाओं के साथ। इसकी सीमा इस प्रकार है: पूर्व - गली 8' चौडी, पश्चिम - सडक 19' चौडी, उत्तर - प्लॉट नंबर 17 का हिस्सा, दक्षिण - अन्य की संपत्ति।

नोट : कर्जदार द्वारा टीसीएचएफएल (सीसी/108/2022) के विरुद्ध दाखिल उपभोक्ता शिकायत डीसीडीआरएफ दक्षिण-पश्चिम (द्वारका) के समक्ष लम्बित है। उक्त मामले में टीसीएचएफएल के विरुद्ध कोई स्टे ऑर्डर पारित नहीं है।

1 0	1.5	00			155	
3.	ТСНН	श्री अशरफ अली पुत्र श्री बुनियाद	रु. 28,19,597/- (रुपये	₹.	₹.	भौतिव
	L0399 00010 00011 06	अली, श्रीमती साइमाबेगम पत्नी अशरफ अली	अट्ठाईस लाख उन्नीस हजार पांच सौ सत्तानबे मात्र)	27,40,000/ (*14	2,74,000/- (रुपये दो लाख चौहत्तर हजार मात्र)	
			14-02-2023			

अचल संपत्ति का विवरण: आवासीय फ्लैट क्रमांक बी/सीए-604 का समस्त भाग, छठी मंजिल पर, टावर/ब्लॉक-बी, टाइप-वी, माप 588.156 वर्ग फीट यानी 54.64 वर्ग मीटर कारपेट एरिया, सिटी अपार्टमेंट, जीएच-06, आदित्य वर्ल्ड सिटी, गाजियाबाद (उत्तर प्रदेश) में स्थित।

4.	10285	श्री मोहम्मद इरफान पुत्र	रु. 41,62,289/- (रुपये	₹.	रु. 2,70,000/- (रुपये दो	भौतिक
	074	श्री राहत अली	इकतालीस लाख बासठ	27,00,000/- (रुपये	लाख सत्तर हजार मात्र)	
		श्रीमती किश्वर जहां पत्नी	हजार दो सौ नवासी मात्र)	सत्ताईस लाख मात्र)		
		श्री मोहम्मद इरफान	24-01-2023			

**अचल सम्पत्ति का विवरण** : बिल्ट अप फ्री होल्ड फ्लैट नंबर बी-14/3/एस-2, दूसरी मंजिल पर, छत के अधिकार के साथ का समस्त भाग, क्षेत्रफल 70 वर्ग गज, यानी 58.53 वर्ग मीटर, एम.आई.जी. श्रेणी के तहत, एक आवास युनिट जैसा है जहां है, सीढियों, मार्ग और अन्य सामान्य सुविधाओं के सामान्य अधिकारों के साथ, संपत्ति संख्या बी-14/3, प्लॉट संख्या बी-14 के हिस्से पर निर्मित, खसरा संख्या 1076/5// 2/272, दिलशाद एक्सटेंशन नंबर 01 में स्थित, अब झिलमिल ताहिरपर, इलाका शाहदरा, दिल्ली के क्षेत्र में दिलशाद कॉलोनी में, बिक्री विलेख में उल्लिखित सभी सामान्य सविधाओं के साथ भिम के अविभाजित आनपातिक फ्रीहोल्ड अधिकारों के साथ। पर्वः रोड, पश्चिमः प्लॉट नंबर बी-14 का हिस्सा, उत्तर- प्लॉट नंबर बी-13, दक्षिणः प्लॉट नंबर बी-14

	528	श्री रिमत गर्ग, गुडविल आयरन एण्ड स्टील ट्रेडर्स प्राइवेट लिमिटेड इसके निदेशक के माध्यम से	करोड़ दस लाख बयासी हजार पांच सौ छिहत्तर मात्र) 24-12-2022	1,20,00,000/- (रुपये एक करोड़ बीस लाख मात्र)		
अचल संपत्ति का विवरणः आवासीय फ्लैट नंबर 603 बिल्डिंग नंबर पी-02 का समस्त भाग, छठी मंजिल, 'क्रिसेंट पारसी पेटीओल्स' गांव वजीरपुरा अं मेवका, एसएआरई होम्स, सेक्टर 92 गुड़गांव 122001 (हरियाणा) लगभग माप 206.8 वर्ग मीटर/2226 वर्ग फीट और फ्लैट खरीदार समझौते के तहत स						

6.	98263 46	श्री जितेन्दर सिंह पुत्र पृथ्वी सिंह,	र. 48,61,248/- (रुपये अड़तालीस लाख इकसठ	रु.	रु.	भौतिक
	&	श्रीमती आशू चौधरी पत्नी श्री	हजार दो सौ अड़तालीस मात्र) अनुबंध सं.	34,60,000/-	3,46,000/-	
	98300	जितेन्दर सिंह	9826346 के तहत आपके द्वारा देय तथा बकाया है		(रुपये तीन	
	89		तथा रु. 1,74,356/- (रुपये एक लाख चौहत्तर		लाख छियालीस	
			हजार तीन सौ छप्पन मात्र) अनुबंध सं. 9830089	मात्र)	हजार मात्र)	
			के तहत आपके द्वारा देय तथा बकाया है अर्थात कुल		Q-11(\(\frac{1}{11}\)1/2/	
			रु. 50,35,596 (रुपये पचास लाख पैंतीस हजार			
			पांच सौ छियानबे मात्र)			
			29-03-2023			

**अचल सम्पत्ति का विवरण** : आवासीय फ्लैट सं. 1203 का समस्त भाग, 12वीं मंजिल, माप सपर एरिया 1280 वर्ग फीट, टॉवर-टांस तथा आवासीय कॉम्पलेक्स रिदम काउंटी में कार पार्किंग स्थान के साथ, प्लॉट नं. जीएच-16 ई, सेक्टर 1, ग्रेटर नोएडा वेस्ट, जिला गौतम बुद्ध नगर, उत्तर प्रदेश 201308 में स्थित बिल्डर केता अनबंध में उल्लिखित अन्य सभी सविधाओं सहित

	<u> </u>	•	9					
7.	94113	श्री अंकुर सिंह,	रु. 82,18,685/- (रुपये	बयासी लार	ब रु. 53,85,000/-	रु. 5,38,500/−	भौतिक	
	43	श्रीमती वृत्ति	अठारह हजार छः सौ पिचासी	मात्र)	(रुपये तिरेपन लाख	(रुपये पांच लाख अड़तीस		
		कुलश्रेष्ठ	24-11-202	Ö	पिचासी हजार मात्र)	हजार पांच सौ मात्र)		
<b>अचल संपत्ति का विवरण</b> : यूनिट नं. 2206, टावर-ए1, रुद्र प्लेस हाइट्स, जीएच-02 बी, सेक्टर-1, ग्रेटर नोएडा (पश्चिम) 201306 उ.प्र., माप 1841 वर्ग फीट								

बिक्री में आम जनता को व्यक्तिगत रूप से निविदा जमा करने के लिए आमंत्रित किया जाता है। कर्जदार(रों)/सह-कर्जदार(रों) को एतद्वारा इस सचना के प्रकाशन की तिथि से 15 दिनों के भीतर भावी ब्याज सहित कुल बकाया भुगतान करने का अन्तिम अवसर दिया जाता है जिसमें असफल रहने पर अचल सम्पत्ति की बिक्री अनुसूची के अनसार कर दी जायेगी। यदि प्राधिकृत अधिकारी के पास अनसची में वर्णित बकाये. ब्याज लागत (बिक्री लागत आदि) जमा कर दी जाती है अथवा उक्त प्रमाणपत्र की राशि, ब्याज एवं लागत अधोहस्ताक्षरी के पास नीलामी की तिथि से पर्व जमा कर दिए होने का उनकी संतष्टि के लिए प्रमाण जमा कर दिया जाता है तो यह बिक्री रोक दी

ऐसे किसी भी अधिकारी या व्यक्ति जिन्हें इस बिक्री के सिलसिले में किसी भी प्रकार के कर्तव्य का निर्वहन करना हो, चाहे प्रत्यक्ष या परोक्ष रूप से, वे बिक्री की जाने वाली

सम्पत्ति में कोई हित अर्जित या अर्जित करने का प्रयास नहीं करेंगे। यह बिक्री प्रतिभृति हित (प्रवर्त्तन) नियमावली, 2002 में निर्दिष्ट शर्तों तथा अधोलिखित शर्तों के अधीन होगी।

5. 9674 श्री रमित गर्ग, श्रीमती मीन गर्ग पत्नी रु. 1,10,82,576/- (रुपये एक

नोट : यह ई-नीलामी बिक्री प्रति 10 मिनट के असीमित विस्तार के साथ पोर्टल https://bankauctions.in/ के माध्यम से 20.03.2024 को 2.00 बजे अप से 3.00 बजे अप के बीच आयोजित की जायेगी। नियम एवं शर्तें : 1. संलग्न अनुसुची में निर्दिष्ट विवरण अधोहस्ताक्षरी की सर्वश्रेष्ठ जानकारी के अनुसार प्रस्तुत किये गये हैं, लेकिन इस उद्घोषणा में किसी गलती अथवा

खामी के लिये अधोहस्ताक्षरी उत्तरदायी नहीं होंगे। यदि बोली राशि अथवा बोलीदाता से संबंधित कोई विवाद उत्पन्न होता है तो प्रतिभत लेनदार के विवेकानसार लॉट को फिर से नीलामी पर प्रस्तत किया जायेगा। 2. आरक्षित मुल्य से कम में सम्पत्ति की बिक्री नहीं की जायेगी। 3. बोली वृद्धि राशि रु. 10,000/- (रुपये दस हजार मात्र) होगी। 4. सम्पत्ति के विक्रय हेत जमा की गयी समस्त संविदाओं के साथ ऊपर लिखे के अनसार जमा धरोहर राशि शाखा पता में देय ''टाटा कैपिटल हाउसिंग फाइनेंस लि.'' के पक्ष में डिमाण्ड ड्राफ्ट के रूप में जमा करनी होगी। असफल संविदाकारों को नीलामी के पश्चात डिमाण्ड ड्राफ्ट वापस कर दिया जायेगा। एनईएफटी/आरटीजीएस/आईएमपीएस के माध्यम से ईएमडी जमा करने के लिए कपया अधिकृत प्राधिकारी से सम्पर्क करें। 5. उच्चतम संविदाकार को सफल संविदाकार घोषित कर दिया जायेगा बशर्ते कि वह संविदा के लिए वैधानिक रूप से पात्र हो और बशर्ते कि उसके द्वारा संविदा की राशि आरक्षित मुल्य से कम न हो। यदि प्रस्तावित मुल्य स्पष्ट रूप से इतना अपर्याप्त हो कि यह ऐसा करने के लिए अपरामर्शनीय हो तो 'अधिकृत प्राधिकारी' का विशेषाधिकार होगा कि वह उच्चतम संविदा की स्वीकृति को मना कर दे। 6. कारणों को अभिलिखित करने हेतु, 'अधिकृत प्राधिकारी' विक्रय को स्थगित/अनिरन्तर करने का विशेषाधिकार रखेगा। 7. सम्पत्ति का निरीक्षण 12.03.2024 को 11 **बजे प्रातः से 5.00 बजे सायं के बीच** किया जा सकता है। 8. सफल क्रेता घोषित किये गये व्यक्ति को ऐसी उद्घोषणा के तुरन्त बाद क्रय राशि/संविदा जिसमें ईएमडी राशि शामिल है, का पच्चीस प्रतिशत 'अधिकृत प्राधिकारी' के पास 24 घंटे के भीतर जमा करना होगा और इस राशि के जमा करने में असफल रहने पर सम्पत्ति को निजी सन्धि द्वारा पुनः नीलामी/बिक्री के लिए रखा जायेगा। 9. यदि उपर्युक्त के अनुसार प्रारम्भिक राशि अदा कर दी जाती है तो क्रय राशि की शेष देय राशि क्रेता द्वारा सम पत्ति के विक्रय की पष्टि की तिथि के 15वें दिन को या इससे पूर्व 'अधिकत प्राधिकारी' के पास जमा करनी होगी. यदि उस 15वें दिन रविवार या कोई अन्य अवकाश होता है तो इसे 15वें दिन के बाद पहले कार्यालयी दिन पर जमा करनी होगी। 10. उपरोक्त अवधि में भुगतान में चूक करने पर निजी सन्धि द्वारा सम्पत्ति की फिर से नीलामी/बिक्री की जायेगी। ईएमडी सहित जमा की गई राशि टाटा कैपिटल हाउसिंग फाइनेंस लिमिटेड द्वारा जब्त कर ली जायेगी तथा चुक करने वाले क्रेता उस सम्पत्ति के सभी दावों से वंचित हो जाएंगे। 11. टाटा कैपिटल हाउसिंग फाइनेंस लिमिटेड को सम्पत्ति के प्रति देय अधिभारों की जानकारी का विवरण शून्य, सम्पत्ति पर रखे गये दावे अथवा उस प्रकृति एवं मुल्य के अन्य ज्ञात विवरणः शन्य। इच्छुक संविदाकार को सम्पत्ति कर, बिजली आदि के विधिक बकायों सहित सम्पत्ति पर ऋणभारों से सम्बन्धित अ पनी स्वतन्त्र पूछताछ करने का परामर्श दिया जाता है। 12. अन्य विवरणों अथवा ऑनलाइन ई-नीलामी प्रक्रिया पर प्रशिक्षण के लिए संभावित बोलीदाता सेवा प्रदाता **मैसर्स** 4क्लोजर, ब्लॉक नं. 605 ए, 6ठा तल, मैत्रीवनम कॉमर्शियल कॉम्पलेक्स, अमीरपेत, हैदराबाद-500038 से इसके समन्वयक श्री अरिजित कुमार दास, मोबाइल नं. 8142000725, 8142000066, 8142000062, ई-मेल : arijit@bankauctions.in तथा ई-मेल info@bankauctions.in अथवा मनीष बंसल से ई-मेल आईडी : Manish.Bansal@tatacapital.com अधिकृत प्राधिकारी मोबाइल नं. 8588983696 से सम्पर्क कर सकते हैं। कपया अपनी पछताछ ह्वाटसएप नम्बर : 9999078669 पर करें। 13. उच्चतम घोषित संविदा राशि पर 1% टीडीएस देना होगा और यह उच्चतम संविदाकार द्वारा अदा किया जायेगा। उच्चतम संविदाकार द्वारा भुगतान स्वामी/कर्जदार(रों) के पैन पर जमा करनी होगी तथा

लिंक देखें। 15. कृपया लिंक https://www.tatacapital.com/property-disposal.html भी देखें। कपया ध्यान दें - टीसीएचएफएल ने इस संपत्ति की बिक्री/नीलामी के लिए उल्लिखित नीलामी भागीदार के अलावा किसी भी दलाल/एजेंट को नियक्त नहीं किया है।

चालान की प्रति हमारी कम्पनी के पास जमा करनी होगी। 14. उपर्युक्त विवरण कृपया लिए प्रतिभूत लेनदार की वेबसाइट http://surl.li/qytno में प्रावधानित

इच्छुक पार्टियों को इस मामले में सभी प्रश्नों और पूछताछ के लिए केवल अधोहस्ताक्षरी या अधिकृत अधिकारी से संपर्क करना चाहिए।

स्थान : दिल्ली, तिथि : 04.03.2024 ह./- अधिकृत प्राधिकारी, टाटा कैपिटल हाउसिंग फाइनेंस लिमिटेड

Shanoo Mathew Company Secretary & Compliance Officer

For SHREE AJIT PULP AND PAPER LIMITED


Disclaimer: Our Company is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to issue Equity Shares on a rights basis and has filed a Letter of Offer with the Securities and Exchange Board of India and Stock Exchange. The Letter of Offer is available on the website of SEBI at www.sebi.gov.in, website of Stock Exchange where the Equity Shares are listed i.e. BSE at www.bseindia.com and the website of the Lead Manager at www.vivro.net. Investors should note that investment in equity shares involves a high degree of risk and are requested to refer to the Letter of Offer including the section "Risk Factors" beginning on page 22 of the Letter of Offer. This announcement does not constitute an offer of Rights Equity Shares for sale in any jurisdiction, including the United States, and any Rights Equity Shares described in this announcement may not be offered or sold in the United States absent registration under the US Securities Act of 1933, as amended, or an exemption from registration. There will be no public offering of Rights Equity Shares in the United States.







डीनः 00454609



## બ્લુ ઈકોનોમી ૨.૦ ને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલની જાહેરાત **ઓનલાઈન** ટ્રાન્ઝેક્શન માટે આંતર-સરકારી પેનલ ઓન સ્તરની આત્યંતિક ઘટનાઓ અને ક્લાઈમેટ ચેન્જ (જીજી) દ્વારા ચક્રવાતની અસરો માટે "કુંદરતી અથવા માનવ દરિયાકાંઠાની વસ્તી અને પ્રણાલીઓમાં થતા ફેરફારો જે જૈવવિધિતાની નબળાઈને હવે OTPની જરૂર નહીં પડે!

સીતારામન દ્વારા ૧ ફેબ્રુઆરીના રોજ આપેલા વચગાળાના બજેટ ભાષણે "સંકલિત અને બહ-ક્ષેત્રીય અભિગમ સાથે પુનઃસ્થાપન અને અનુકૂલનનાં પગલાં, દરિયાકાંઠાના જળચરઉછેર અને મેરીકલ્ચર માટે" નવી યોજનાની જાહેરાત સાથે બ્લુ ઈકોનોમી ૨.૦ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જો કે, કેન્દ્રીય મંત્રીએ આ યોજના માટે બજેટની ફાળવણી અથવા તેમાં કઈ પ્રવૃત્તિઓ સામેલ થશે તે અંગેની ચોક્કસ વિગતો

જણાવવાનું ટાળ્યું હતું. જ્યારે આ વિકાસ આજીવિકાની દ્રષ્ટિએ અને આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોને અનુરૂપ ભારતના ૭,૫૦૦ કિમી વિસ્તારના દરિયાકિનારે (મુખ્ય ભૂમિ અને ટાપુઓ બંનેનો સમાવેશ કરે છે) સાથે માહીમાડી અને સંગ સાથે માછીમારી અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાયેલા ૧૪ મિલિયન લોકો માટે સકારાત્મક છે, ત્યારે સંભવિત ખોડખાંપણ અંગે ચિંતાઓ યથાવત છે. ગેરમાર્ગે દોરેલા અનકલનનાં પગલાં.

અજાણતા આબોહવા ઉત્તેજનાની નબળાઈમાં વધારો કરે છે" તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ માલાડેપ્ટેશન, સમુદાયો પર આબોહવા પરિવર્તનની અસરોમાં અજાણતા વધારો દર્શાવે છે.

માર્ચ ૨૦૨૩માં બહાર પાડવામાં આવેલ કેંઝઝનો છકો આકારણી અહેવાલ (છઇફ) વિવિધ ક્ષેત્રો અને પ્રદેશોમાં ગેરલાભાની વધતી ઘટનાઓને પ્રકાશિત કરે છે. ભારતના દરિયાકિનારા પર

આવા ઘણા અનુકૂલનનાં પગલાં લેવામાં આવ્યા છે. આમાં દરિયાકાંઠાના ધોવાજાથી પ્રભાવિત ગામોનું સ્થળાંતર, જીઓસિન્થેટીક ટશુબ જેવા સંરચનાઓ દ્વારા દરિયાકિનારાનું રક્ષણ અને મેન્પ્રોવ પુનઃસ્થાપનનો સમાવેશ થાય છે. જો કે, આમાંના ઘણા પગલાં, ખાસ કરીને ઓડિશાના દરિયાકાંઠે, દરિયાઈ સપાટીમાં વધારો, દરિયાઈ જવાવાવવતાના નખળાઇન ઘટાડવામાં બિનઅસરકારક સાબિત થયા છે. ઉદાહરણ તરીકે, ઓડિશાના પેંથા ગામમાં જીઓ સિન્ઘેટીક ટ્યુબની સ્થાપનાને કારણે ગામની દક્ષિણ અને ઉત્તર બંને બાજુના દરિયાકિનારા પરથી દરિયાકાંઠાનું કાર તાલ મેરના કાર તાલકાડાનું ધોવાણ થયું હતું, જેના કારણે વાવાઝોડાના તોફાનો અને દરિયાઈ સ્તરની આત્યંતિક ઘટનાઓ દરમિયાન તેમની નજીક રહેતા

લોકો જોખમમાં મૂકાયા હતા તેના બદલે, અસરકારક અનુકૂલનનાં પગલાં જેમ કે સ્વદેશી સીવીડની ખેતી, કૃત્રિમ ખડકોની જમાવટ, અને દરિયાકિનારાના રેતીના ટેકરાઓનું સ્થિરીકરણ અનુકૂલન જરૂરિયાતો અને ઘટાડાનાં પગલાં બંને માટે પ્રાથમિકતા આપવી જોઈએ. આ અભિગમો દરિયાકાંઠાને ધોવાણ સમદાયોને આજી વિકા પરી

દરિયાકાંઠાના યોગ્ય ભાગોમાં

પાડવામાં ફાળો આપી શકે છે એક્વાકલ્ચરના આ પાસાને લગતી બજેટની જાહેરાતને ઉષ્માભર્યું આવકાર મળ્યો હતો. સીવીડ સંશોધક અને દિલ્હી યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર દિનબંધુ સાહૂના જણાવ્યા અનુસાર, ભારતમાં જ્યાંવ્યા અનુસાર, ભારતના જળચરઉછેર મુખ્યત્વે માછલી, પ્રોન અને અન્ય જળચર પ્રાણીઓ પર કેન્દ્રિત છે.પર્યાવરણીય ચિંતાઓને સંબોધવા માટે, સાહૂ દરિયાઇ ઇકોસિસ્ટમમાંથી કાર્બન ડાયો કસાઇડ, નાઇટ્રોજન અને

વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને પસંદગીની સ્વદેશી સીવીડ પ્રજાતિઓની ખેતી પર ભાર મકે છે

સીવીડ, તેમના પર્યાવરણીય મો ઉપરાંત, પ્રોટીનના મૂલ્યવાન સ્રોત તરીકે સેવા આપી શકે છે. અર્કિત પ્રોટીન સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં એપ્લિકેશન શોધે

સાહૂ ભારતમાં સીવીડની ખેતીની પ્રમાણમાં નવી પ્રથાને કારણે વિવિધ હિસ્સેદારો તરફથી જાગરૂકતા અને હસ્તક્ષેપની જરૂરિયાત પર નવી દિલ્હી, ઓનલાઈન વિકલ્પોપજ્ઞવિકસાવ્યા છે. પરંતુ આ જ્યાં સેવા પ્રદાતા ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડીના બધીપ્રક્રિયાઓ માટેકોનની જરૂરપડે વપરાશકર્તાઓના ઉપકરણ સાં કિસ્સાઓ વધી રહ્યા છે. આને રોક્લા છે. આ માટે RBIએ બેંકોને SMS ડેટા કનેક્શન હશે. તે મોલ્ માટે આરબીઆઈ સમયાંતરે કામ આધારિત વન-ટાઇમ પાસવર્ડ કરતી રહે છે. હવે આરબીઆઈ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે (OTP)ના વિકલ્પ પર વિચાર કરવા (OTP)ના ાવકલ્ય પર ાપચાર કરવા કહ્યું છે. પરંતુ વિકલ્પ ગમે તે હોય, મોબાઈલ ફોનની ઉપયોગિતા યથાવત રહેશે. બેંકર્સ કહે છે કે OTPs એક નવી સિસ્ટમ બનાવવા જઈ રહી છે, જેથી તમારે પેમેન્ટ કરવા માટે છેતરપિંડી માટે સંવેદનશીલ હોય છે, જ્યાં કોઈ વ્યક્તિ ગ્રાહકોને પાસવર્ડ OTPની જરૂર નહીં પડે. હાલમાં, કો ઈપણ જગ્યાએ કો ઈપણ ઓનલાઈન વ્યવહાર કરવા માટે, આપીને અથવા સિમ સ્વેપ દ્વારા તેને પકડી શકે છે. રૂટ મોબાઈલના એમડી તમને ચકાસણી માટે SMS દ્વારા OTP પ્રાપ્ત થાય છે. આ OTP પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે ઓનલાઈન પેમેન્ટમાં કોઈ ખલેલ કે છેતરપિંડી ન થાય.OTP નો સૌથી સામાન્ય વિકલ્પ અને સીઈઓ રાજદીપકુમાર ગુપ્તા કહે છે કે તેમની કંપની વિવિધ સર્વિસ પ્રોવાઈડર્સ વતી દર મહિને લગભગ ૪૦૦ કરોડ OTP મોકલે છે. પરંતુ, ઓ શેન્ટિ કેટર એ પાછે આ માટે િજિટલ મિસ્ટમના વિકાસ સાથે વપરાશકર્તાઓને તેમના મોબાઇલ ફોન પરની અન્ય એપ્લિકેશનમાંથી છેતરપિંડીની શક્યતા પણ વધે છે. તેમણે જણાવ્યું હતું કે વધતી જતી પાસવર્ડ પુનઃપ્રાપ્ત કરવાની જરૂર છે. સેવા પ્રદાતાઓએ મોબાઇલ એપ્લિકેશન્સમાં ટોકન્સ જેવા અન્ય છેતરપિંડીથી કંપની ટૂઅન્સ ડિવિઝન શરૂ કરવા માટે પ્રેરિત થઈ છે. ટૂસેન્સે OTP-લેસ પ્રમાણીકરણ રજૂ કર્યું છે,

ડેટા કનેક્શન હશે. તે મોબાઈલ નંબરની ઓળખ કરશે અને વપરાશકર્તાને દાખલ કર્યા વિના ઉપકરણ સાથે ટોકનનું વિનિમય કરશે. ડેવિડ વિગર, ડિજિટલ ઓળખના એક્ઝિક્યુટિવ વીપી, કહે છે કે બાયોમેટ્રિક્સ એકમાત્ર શ્રેષ્ઠ પ્રમાણીકરણ વિકલ્પ નથી, કારણ કે છૈં માં એડવાન્સિસે ચહેરાની ઓળખને બાયપાસ કરીને ડીપફેક્સનું નવું જોખમ ઊભું કર્યું છે. વિગરના મતે, મોબાઇલ ફોન ભારતીય બજાર માટે શ્રેષ્ઠ ઓળખકર્તા છે કારણ કે ગ્રાહકે કનેક્શન મેળવતા પહેલા તેની ઓળ ખની ચકાસણી કરવી પડે છે. ઈમેઈલ એટલો સારો વિકલ્પ નથી, કારણ કે નકલી ઈમેલ ઓળખ બનાવવી સરળ છે. વધુમાં, કોઈપણ કેવાયસી વિના ઈમેલ જનરેટ કરી

# વરુએ એવું જાનવર જેને આજ સુધી કંટ્રોલ નથી કરી શક્યાં માણસ



દુનિયામાં એવા કોઈ જાનવર શી, જેના ગળામાં માણસે પટ્ટો ન પહેરાવ્યો હોય. ત્યાં સુધી કે જંગલના વાદ્ય સિંહ ચિત્તાને પણ પાળવામાં આવે છે, પરંતુ ઘણાં લોકો એવું નથી જાણતા કે જંગલમાં એક એવું જાનવર છે જેણે આજસધી ગલામી સ્વીકારી

કહાનીઓ પણ છે. તેમ છતાં એક જાનવર એવું છે, જેને માણસ ક્યારે પાળી નથી શક્યાં. શું તમે જાણો છો તેનું નામ શું છે? ચાલો તમને થોડા સંકેત આપીએ. આ જાનવર હોલિવૂડ અને બોલિવૂડ ફિલ્મોમાં બતાવવામાં આવ્યા છે. કશારેક પિશાચના રુપમાં તો કથારેક નરભક્ષીના રુપે. ઈટાલિયન "ધ સિટી ઑફ ગૉડ"ના લેખકે આ પ્રાણીની તુલના એક ચુડેલ સાથે કરી છે. જી હાં, આ ખૌફનાક જીવ વરુ છે. વાઇલ્ડલાઇફ એક્સપર્ટ સ્વપ્રિલ ખટાલ છેલ્લા ૨૨ વર્ષથી ભારતના જંગલોમાં જંગલી પાણીઓ સાથે કામ કરી રહ્યા છે. તેણે ઘણી વખત ખતરનાક જીવોનો સામનો કરવો પડ્યો હતો. જીવનું જોખમ પણ હતું. પરંતુ દર વખતે કોઈને કોઈ પ્રકારે જીવ બચી ગયો. સ્વપ્નિલ જાનવરોને જે સમૂહને જોઈને સૌથી વધારે ખતરનાક માનો છો, તે વરુ છે. વરુ એક એવું પ્રાણી છે જેને લોકો લાખો પ્રયત્નો છતાં કાબૂમાં કરી શક્યા નથી. તેઓ સમૂહમાં છે. પરિવારનું ધ્યાન રાખે છે. વડીલોને તેમના સમૂહમાં ખૂબ આદર આપવામાં આવે છે. બિલ્કુલ માણસોની જેમ જ. એક પુષ્ત વરુના ૪૨ દાંત હોય છે, જે એટલા મજબૂત હોય છે કે તેઓ મોટા હાડકાંને સરળતાથી ચાવી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે

મોઝામ્બિક જેવા દેશો સાથેના સોદાના અહેવાલો પણ સપાટી પર આવ્યા છે. જયારે સૂચિત લક્ષ્ય અશ્મિભૂત ઇંધણથી કમિશનની

સ્વતંત્રતા વધારવાની અપેક્ષા છે, ત્યારે

આ સોદાઓ ૨૦૫૦ પછી ગેસની આયાતમાં સારી રીતે પરિણમશે તેવી

અપેક્ષા છે. આ સોદાઓ કાર્બન લૉક-ઇન અને અટવાયેલી અસ્કયામતોના ઊંચા જોખમમાં

પરિભ્રમી શકે છે , ખાસ કરીને આફ્રિકન ખંડના દેશો માટે કે જેઓ નિકાસને ટેકો આપવા માટે ક્ષમતા

બનાવી રહ્યા છે અને તેથી વધુ જો EUનું નવું આબોહવા લક્ષ્ય આખરે અશ્મિભૂત ઇંધણની આયાત્

અશ્મિભૂત ઇંધણની આયાત ઘટાડવાની સુવિધા આપે છે. જ્યારે

૫૫ ટકા ઘટાડાનો ૨૦૩૦નો ધ્યેય ૧૯૯૦ના સ્તરના આધારે CO2

સમકક્ષ ૨.૧૬ ગીગાટોનના નિરપેક્ષ

ઉત્સર્જન સ્તર તરફ દોરી જશે, જયારે ૯૦ ટકા ધ્યેયનો અર્થ ર્ઝંટ સમકક્ષ

૦.૪૮ ગીગાટોનનું સંપૂર્ણ ઉત્સર્જન

સ્તર હશે. જો કે, નાગરિક સમાજે ઐતિહાસિક પ્રદૂષક તરીકે તેની

જવાબદારી સાથે તેના લક્ષ્યોને અનુરૂપ ન રાખવા બદલ EUની ટીકા કરી છે. ક્લાઈમેટ એક્શન ટ્રેકર સૂચવે છે કે કમિશનને આદર્શ રીતે

૧.૫ઝ પાથવે પર રહેવા અને તેના વાજબી હિસ્સાને સંબોધવા માટે

૧૯૯૦ના સ્તરની સરખામણીમાં

૧૦૩૦ સુધીમાં ૬૫ ટકા ઉત્સર્જન ઘટાડવા અને ૨૦૪૦ સુધીમાં ઓછામાં ઓછા ૯૫ ટકાના ઘટાડાનું

લક્ષ્ય જરૂરી છે.

ફિલ્મમાં બતાવવામાં આવેલા મોટાભાગના વરુઓ સાઈબેરીયન છે. તેનું કદ કૂતરા કરતા ઘણું મોટું છે. તાનુ કદ ફૂતરા કરતા વજી નાહુ છે. આખું શરીર જાડા વાળથી ભરેલું હોય છે. પરંતુ ભારતમાં જોવા મળતા વરુ બિલકુલ કૂતરા જેવા છે. તેમનું કદ પણ લગભગ સમાન છે. શરીર પર બહુ ઓછા વાળ હોય છે. બિહારના પશ્ચિમી ચંપારણ જિલ્લાના ટાઈગર રિઝર્વ ફોરેસ્ટમાં પણ ઘણા વર જોવા મળે છે. ભારતીય વરુઓનો વિશ્વમાં સૌથી જૂનો ઇતિહાસ છે, પરંતુ તેઓ હાલમાં લુપ્ત થવાની આરે છે આ જ કારણ છે કે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તેમને લુપ્તપ્રાય પ્રાણીઓની શ્રેણીમાં -ગખવામાં આવ્યા છે. વાઈલ્સ્લાઈક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના તાજેતરના અભ્યાસ મુજબ, કૂતરાઓ સાથે ક્રૉસ-બ્રીડિંગના વરુના જીન્સ પર ખરાબ

# EU એ ૨૦૪૦ માટે નવા આબોહવા ધ્યેય નક્કી કર્યા - ઉચ્ચ મહત્વાકાંક્ષા, છતાં અંતર યથાવત છે

યુરોપિયન યુનિયન (EU) એ નિર્ણાયક આઉટપુટ અશ્મિભૂત યુરોપિયન કમિશન દ્વારા તેના નવા સૂચિત ૨૦૪૦ આબોહવા ધ્યેયની રજૂઆત કરી. તેણે ૧૯૯૦ના રજૂ આત કરા. તહા ૧૯૯૦ના બેઝલાઇન સ્તરોની સરખામણીમાં ૨૦૪૦ સુધીમાં ૯૦ ટકાના ચોખ્ખા ઉત્સર્જનમાં ઘટાડાનો લક્ષ્યાંક રાખ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦ માં. FU એ ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જનને ૨૦૩૦ સધીમાં ૧૯૯૦ ના સ્તરથી પપ ટકા ઘટાડવાનું લક્ષ્ય જાહેર કર્યું હતું, જે અગાઉ ૪૦ ટકા હતું. તે ડિસેમ્બર ૨૦૨૦ માં યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) માં બીજા રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન

તરીકે સબિમેટ કરવામાં આવ્યું હતું. તે ૨૦૨૧ માં EU ક્લાયમેટ લોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું જેણે ૨૦૫૦ સધીમાં કોર્બન , કક્ષ ૧૭૧૭ સુતા કાર્યો તટસ્થતા સુધી પહોંચવાની પ્રતિબથ્તા પણ દર્શાવી હતી. લક્ષ્યાંકને સાથ આપવા માટે, કમિશને ૨૦૨૧ માં ' પપ માટે ફિટ " પેકેજ બહાર પાડ્યું હતું, જેણે હાંસલ કરવા માટે દરખાસ્તોનો સમૃહ પ્રદાન કર્યો હતો.

ઈં આબોહવા કાયદા દ્વારા જરૂરી એક વચગાળાનું પગલું છે, જે પ્રથમ થ્લોબલ સ્ટોક્ટેક (GST) ના છ મહિનાની અંદર ૨૦૪૦ લક્ષ્ય વિકસાવવા માટેની પ્રક્રિયાની ૩૫૨ેખા જે દુબઈમાં UNFCCCની ૨૮ મી કોન્કરન્સ ઑફ પાર્ટીઝમાં સમાપ્ર થઈ હતી. ડિસેમ્બર ૨૦૨૩ માં. અશ્મિભૂત ઇંધણ તબક્કાવાર કોલસા માટે સમયરેખા જુએ છે, પરંતુ ચેતવણીઓ સાથે જી.એસ.ટી.ન

ઇંધણથી દૂર સંક્રમણનું કોલ હતું. EU દ્વારા ૨૦૪૦નો લક્ષ્યાંક આને અનુરૂપ એક રોડમેપની રૂપરેખા આપે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૪૦ સુધીમાં કોલસો લગભગ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે, કુદરતી ગેસનો વપરાશ ઝડપથી ઘટશે અને તેલ તબક્કાવાર રીતે સમાપ્ત થવા માટે

છલ્લુ હરા. જો કે, તેણે ઉમેર્યું હતું કે થોડી સંખ્યામાં અશ્મિભૂત ઇંધણ મિશ્રણમાં રહેશે અને મોટાભાગે બિન-ઊર્જા હેતુઓ અને લાંબા અંતરના પરિવહન માટે ઉપયોગમાં લેવાશે. અશ્મિભૂત ઇંધણની આયાતમાં ઘટાડો થશે કારણ કે ઊર્જા મિશ્રણ બદલાશે, તે જ સમયે નવીનીકરણીય ઉર્જા સ્રોતોની ઝડપી જમાવટની જરૂરિયાત કાચા માલ અને નિર્ણાયક ખનિજોની આયાત તરફ દોરી શકે છે, લક્ષ્યે જણાવ્યું હતું. યુક્રેન પરના યુથ્ને કારણે યુરોપિયન યુનિયનમાં ઉર્જા કટોકટી સર્જાઈ, જે તેની કુદરતી ગેસની જરૂરિયાતો માટે રશિયા પર ભારે નિર્ભર હતી. સપ્લાયમાં લગભગ ૮૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે કમિશનને તેના ઉર્જાસપ્લાયર્સઅને મિશ્રણમાં વિવિધતા લાવવાની કરજ પડી હતી ત્યારથી તે લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ની ચાવીરૂપ આયાતકાર છે.

સમાંતર રીતે, તેણે ૨૦૨૨ માં વીજળી ઉત્પાદન માટે પવન અને સૌરથી આગળ નીકળતા અશ્મિભૂત ગેસ સાથે, નવીનીકરણીય ઊર્જાના વપરાશમાં રેકોર્ડ વધારો જોયો છે . EU LNG આયાત માટે યુનાઇટેડ

સ્ટેટ્સ, મધ્ય પૂર્વ અને આફ્રિકા પર

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI.
PUBILATION PVT. LTD. and Printed at : Dhart Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201, 202, 208 Nandan complex, opp mithakhali riy crossing, mithakhali, ahmedabad. Editor : Mayur C. Bhatt યુરોપિયન યુનિયન સાયન્ટિફિક એડવાઈઝરી બોર્ડ ફોર ક્લાઈમેટ ચેન્જે પણ ૯૦-૯૫ ટકાની રેન્જ ઘટાડવાનં સૂચન કર્યું હતું અને અંતિમ દરખાસ્ત રેન્જની નીચલી મર્યાદામાં અટકી

બંનેએ તાજેતરમાં કતાર સાથે ગેસના સોદા કર્યા છે અને નાઈજીરીયા અને

ગઈ હોય તેવું લાગે છે. દુનિયામાં એવા કોઈ જાનવર નથી, જેના ગળામાં માણસે પટ્ટો ન પહેરાવ્યો હોય. ત્યાં સુધી કે જંગલના વાઘ, સિંહ, ચિત્તાને પણ પાળવામાં આવે છે, પરંતુ ઘણાં લોકો એવું નથી જાણતા કે જંગલમાં એક એવં જાનવર છે જેવે આજસુધી ગુલામી સ્વીકારી નથી. ઘણાં પ્રયત્ન બાદ પણ તેને વશમાં નથી કરી શકાતા. તેના વિશે ઘણી નથા કરા શકાતા, તના વિશ ધણા કહાનીઓ પણ છે. તેમ છતાં એક જાનવર એવું છે, જેને માણસ ક્યારે પાળી નથી શક્યાં. શું તમે જાણે છો તેનું નામ શું છે? ચાલો તમને થોડા સંકેત આપીએ. આ જાનવર હોલિવૂડ અને બોલિવૂડ ફિલ્મીમાં બતાવવામાં આવ્યા છે. કથારેક પિશાચના રુપમાં તો કથારેક નરભક્ષીના રુપે. ઈટાલિયન "ધ સિટી ઑફ ગૉડ"ના લેખકે આ પ્રાણીની તલના એક ચડેલ સાથે કરી છે. જી હાં, આ ખૌફનાક જીવ વરુ છે. વાઇલ્ડલાઇફ એક્સપર્ટ સ્વપ્રિલ ખટાલ છેલ્લા ૨૨ વર્ષથી ….. ાડાન ઝરના ૨૨ પત્રથ ભારતના જંગલોમાં જંગલી પ્રાણીએ વખત ખતરનાક જીવોનો સામનો કરવો પડ્યો હતો. જીવનું જોખમ પણ હતું. પરંતુ દર વખતે કોઈને કોઈ પ્રકારે જીવ બચી ગયો. સ્વપ્રિલ જાનવરોને જે સમૂહને જોઈને સૌથી વધારે ખતરનાક માનો છો, તે વરુ છે. વરુ એક એવું પ્રાણી છે જેને લોકો લાખો પ્રયત્નો છતાં કાબૂમાં કરી શક્યા નથી. તેઓ સમૂહમાં છે. પરિવારનું ધ્યાન રાખે છે. વડીલોને તેમના સમૃહમાં ખૂબ આદર આપવામાં આવે છે. બિલ્કુલ માણસોની જેમ જ. એક પુષ્ત વરુના ૪૨ દાંત હોય છે, જે એટલા મજબૂત હોય છે કે તેઓ મોટા હાડકાંને સરળતાથી ચાવી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મમાં બતાવવામાં આવેલા

મોટાભાગના વરુઓ સાઈબેરીયન

## SHREE AJIT PULP AND PAPER LIMITED

OUR PROMOTERS: GAUTAM SHAH, SURESH SHAH, BELA SHAH AND SUNITA SHAH

ISSUE OF UP TO 35,71,133 PARTLY PAID-UP EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH OF QUIR COMPANY ("RIGHTS EQUITY SHARES") FOR CASH AT A PRICE OF ₹80 EACH (INCLUDING A PREMIUM OF ₹70 PER RIGHTS EQUITY SHARES, AGGREGATING UPTO ₹2,856.91 LAKPY SHARES TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF Z (TWO) EQUITY SHARE FOR EVERY 3 (THREE) PULLY PAID-UP EQUITY SHARES HAD BY THE ELIGIBLE EQUITY SHARES HAD SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON THURSDAY, JANUARY 18, 2024 (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS 81 (EIGHT) THISS THE FACE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, PLEASE REFER TO THE CHAPTER TITLED "TERMS OF THE ISSUE" ON PAGE 158 OF THE LETTER OF OFFER.

"KASSUMING JUIL SUSCEPTION AND CREGIT OF A ILC THE THE OF OFFER."

Amount payable per Rights Equity Share*	PAYMENT SCHEDULE			
Allount payable per hights Equity share	Face Value (₹)	Premium (₹)	Total (₹)	
On Application	6	42	48	
On First and Final Call®	4	28	32	
Total (₹)	10	70	80	

BASIS OF ALLOTMENT

The Board of Directors of our Company thanks all investors for the response to the Issue, which opened for subscription on Tuesday, January 30, 2024, and closed on Tuesday, February 20, 2024, and the last date for 0n Market Renunciation of Rights Entitlements was Thursday, February 15, 2024. Out of the total 2,139 Applications for 94,26 829 Rights Equity Shares, 766 Applications for 19,56 287 Rights Equity Shares, when were rejected due to technical reasons as disclosed in the Letter of 10ffer. The total number of validate Applications received was 1,373 for 92,317 Rights Equity Shares, which was 230,50% of the number of Rights Equity Shares when was 230,50% of the number of Rights Insective of 10ffer. The total number of was 230,50% of the number of Rights Insective Applications and the Bassis of Allotment Inalized on February 25, 2024, in consultation with 95E Timeter ("8E"), the Designated Stock Exchange, the Lead Manager to the Issue and the Repietar to the Issue. The Rights Issue Committee of the Company, pursuant to the deglation of authority to the Rights Issue Committee of the Company, pursuant to the deglation of authority to the Rights Issues Committee of the Company, pursuant to the deglation of authority to the Rights Issues committee of the Company, pursuant to the deglation of authority to the Rights Issues of the Rights Issues Committee of the Company, pursuant to the deglation of authority to the Rights Issues committee by the Board of Directors at their meeting held on February 25, 2024 approved the allotment of 35,71,133 partly paid up Rights Equity Shares to the successful Application in the Issue, no Rights Equity Shares to the successful Application in the Issue and Company and the Rights Equity Shares to the successful Application in the Issue and Rights Equity Shares the successful Applications after the rejection of Mercenter and Research Researc

	Category	No. of valid applications received	No. of Rights Equity Shares accepted and allotted against Entitlements (A)	No. of Rights Equity Shares accepted and allotted against Additional Rights Equity Shares applied (B)	Total Rights Equity Shares accepted and alloted (A+B)
	Shareholders	1,241	31,91,168	2,76,222	34,67,390
	Renouncees	132	1,03,743	-	1,03,743
	Total	1,373	32,94,911	2,76,222	35,71,133
ı	0 1-1	1-1-1 1 E E E E E E E E			

35.71.133 17.14.14.384

INVESTORS MAY PLEASE NOTE THAT THE EQUITY SHARES CAN BE TRADED ON THE STOCK EXCHANGES ONLY IN DEMATERIALIZED FORM

Unless otherwise specified, all capitalised terms used herein shall have the same meaning ascribed to such terms in the Letter of Offer.

THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES OR THE COMPANY.

LEAD MANAGER TO THE ISSUE **VIVRO** 

Vivro Financial Services Private Limited Vivro House, 11, Shashi Colony, Opp. Suvidha Shopping Centre, Paldi, Ahmedabad – 380 007,

Investor Grievance E-mail: investors@vin Contact Person: Kruti Saraiya/ Jay Dodiya SEBI Registration No.: INM000010122

REGISTRAR TO THE ISSUE **LINK**Intime

Link Intime India Private Limited C 101, 247 Park, L.B.S. Marg, Vikhroli (V Murmbai – 400083, Maharashtra, India. Telephone: +91 810 811 4949 Email: ajitPrightsissue@linkintime.co.in

tićg

tors may contact the Registrar or our Compliance Officer for any pre-Issue/post-Issue related matter. All grievances relating to the ASBA process may be addressed. Registrar, with a copy to the SCSBs, giving full details such as name, address of the Applicant, contact number(s), enable (b) to the sole "first holds", or or of enable account number, serial number of the Application Form, number of Rights Equity Shares, applied for, amount blooked, ASBA Account number and the number of the Application Form, or the part of Rights Equity Shares, applied for, amount blooked, ASBA Account number and the natable Shareh of the SCSBs where the Application Form, or the places as the case may be 160 of the source of the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy of the acknowledgement slip. For details on the ASBA Investors along with a copy

For SHREE AJIT PULP AND PAPER LIMITED